

**AI-116****April-2015****M.A., Sem-IV****510 : Psychology****(Statistical Inference)****Time : 3 Hours]****[Max. Marks : 70**

- સ્વીચ્છા :** (1) નોન પ્રોગ્રામેબલ કેલક્યુલેટરનો ઉપયોગ કરી શકશે.  
 (2) દશાંશ બિંદુ પણી ગ્રણ સ્થાન સુધીની ચોક્સાઈથી ગણતરી કરો.

1. નીચેની માહિતી પરથી બહુચલીય સહસંબંધ R1 (2, 3, 4) શોધો : 14

	X1	X2	X3	X4
X1	–	0.82	0.78	0.92
X2	–	–	0.83	0.70
X3	–	–	–	0.69
X4	–	–	–	–

**અથવા**

- નીચેની માહિતી પરથી બહુચલીય સહસંબંધ Ra (b, c, d) શોધો :

a	b	c	d
a	–	0.55	0.38
b	–	–	0.46
c	–	–	–
d	–	–	–

2. નીચે આપેલી માહિતી પરથી આસંગ સહસંબંધ ગુણાંકની ગણતરી કરો અને 0.05 સાર્થકતાની કક્ષાએ શૂન્ય પરિકટ્યનાની ચકાસણી કરો : 14

સામાજિક-આર્થિક સ્થિતિ	આવેગાત્મક પરિપક્વતાની કક્ષા		
	ઉચ્ચ	મધ્યમ	નિમ્ન
ઉચ્ચ	30	50	30
મધ્યમ	10	40	20
નિમ્ન	20	50	40

**અથવા**

નીચે આપેલી માહિતીના આધારે ગુડમેન કુસ્કલ ગામા ગુણાંક વડે 0.05 સાર્થકતાની કક્ષાએ શૂન્ય પરિકલ્પનાની ચકાસણી કરો :

X	Y
42	25
39	26
56	31
36	17
49	35

3. નીચે આપેલી માહિતીના આધારે વિચરણ પૃથ્વકરણની ગણતરી કરી 0.05 સાર્થકતાની કક્ષાએ શૂન્ય પરિકલ્પનાની ચકાસણી કરો :

14

A1				A2			
B1		B2		B1		B2	
C1	C2	C1	C2	C1	C2	C1	C2
53	30	43	16	67	56	51	41
32	41	39	28	57	41	45	47
65	32	41	30	51	66	67	56

અથવા

નીચે આપેલી માહિતી પરથી વિચરણની સમરૂપતા બાર્ટલેટની કસોટી વડે ચકાસો :

Sr. No.	I	II	III	IV
1	08	05	10	07
2	07	06	07	08
3	06	07	08	10
4	05	08	09	09
5	03	04	06	06

4. નીચેનામાંથી કોઈપણ બે પ્રશ્નોના ઉત્તર આપો :

14

- (1) નીચે આપેલ માહિતી પરથી વિલોકન સમતુલ્યત જોડ ચિન્ન ક્સોટી દ્વારા 0.05 સાર્થકતાની કક્ષાએ શુન્ય પરિકલ્પનાની ચકાસણી કરો :

Pairs	1	2	3	4	5	6	7	8	9	10
Method-I	14	14	21	10	13	25	13	25	21	23
Method-II	09	14	25	02	08	15	12	24	13	16

- (2) નીચે આપેલ માહિતી દ્વારા કોચરન 'Q' ક્સોટીનો ઉપયોગ કરી શુન્ય પરિકલ્પનાની ચકાસણી કરો :

પદ્ધતિઓ	1	2	3	4	5	6	7	8	9	10
I	1	0	0	1	0	1	1	1	0	1
II	1	0	1	0	1	1	0	1	0	0
III	1	1	0	0	1	0	1	0	0	1

- (3) સમતુલ્યત કરેલા ચાર જૂથોના પ્રયોગપાત્રોએ ચાર જુદી-જુદી પરિસ્થિતિઓમાં નીચે પ્રમાણે પ્રાપ્તાંકો મેળવ્યાં. ફાર્ડરમેનનાં કમાંકલથી દ્વિમાળી વિચરણ વિશ્લેષણ વડે પરિસ્થિતિઓ વચ્ચેના તફાવતની સાર્થકતા 0.05 કક્ષાએ ચકાસો :

Groups (N)	Conditions (K)			
	I	II	III	IV
A	10	06	05	08
B	07	07	05	08
C	10	04	07	09
D	06	03	05	05

- (4) ત્રણ શાળાના કેટલાક વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્યની ક્સોટી આપવામાં આવી. ક્સોટીમાં તેમણે મેળવેલા પ્રાપ્તાંકો નીચે મુજબ છે. કુસ્કલ વોલિસ ક્સોટી વડે શુન્ય પરિકલ્પના 0.05 સાર્થકતાની કક્ષાએ ચકાસો :

શાળા	પ્રાપ્તાંકો							
X	20	32	23	40	26	34	37	52
Y	15	28	33	36	30	38	31	
Z	30	42	33	50	36			

5. નીચેના પ્રશ્નોના ટૂકમાં જવાબ આપો : (કોઈપણ સાત)

14

- (1) આંશિક સહસંબંધનો અર્થ આપી, તેના પ્રકારો જણાવો.
  - (2) આસંગ સહસંબંધ ગુણાંકનો અર્થ આપી, તેનો ઉપયોગ ક્યારે કરી શકાય તે જણાવો.
  - (3) વિચરણ વિશ્લેષણ એટલે શું ? ત્રિમાર્ગી વિચરણ વિશ્લેષણનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  - (4) બાર્ટલેટની વિચરણ સમરૂપતા કસોટીનો અર્થ આપી, તેનો ઉપયોગ જણાવો.
  - (5) શૂન્ય પરિકલ્પના એટલે શું ?  $H_0$  (શૂન્ય પરિકલ્પના) ક્યારે સ્વીકૃત અને ક્યારે અસ્વીકૃત થાય ?
  - (6) કોચરન ‘Q’ કસોટીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
  - (7) કુસ્કલ વોલિસ કસોટીનો ઉપયોગ અને તેમાં કઈ સારણીનો ઉપયોગ કરવામાં આવે છે તે જણાવો.
  - (8) ફાઈડમેન દ્વિમાર્ગી વિચરણ પૃથ્વીકરણનો ઉપયોગ જણાવો.
  - (9) સ્વાતંત્ર્યની માત્રાનો અર્થ જણાવો.
-

**AI-116**  
**April-2015**  
**M.A., Sem.-IV**  
**510 : Psychology**  
**(Statistical Inference)**

**Time : 3 Hours]****[Max. Marks : 70**

- Instructions :** (1) Non-programmable calculator can be used.  
(2) Calculation should be done upto three decimal.

1. Calculate multiple correlation R<sub>1</sub> (2, 3, 4) from following data :

**14**

	X1	X2	X3	X4
X1	–	0.82	0.78	0.92
X2	–	–	0.83	0.70
X3	–	–	–	0.69
X4	–	–	–	–

**OR**

- Calculate multiple correlation R<sub>a</sub> (b, c, d) from following data :

a	b	c	d
a	–	0.55	0.38
b	–	–	0.46
c	–	–	–
d	–	–	–

2. Calculate contingency correlation co-efficient from the given data and test the null hypothesis at 0.05 significance level. **14**

Socio-economic Status	Level of Emotional Maturity		
	High	Medium	Low
High	30	50	30
Medium	10	40	20
Low	20	50	40

**OR**

Calculate the Goodman Kruskal Gama co-efficient from the following data. Test the null hypothesis at 0.05 significance level.

<b>X</b>	<b>Y</b>
42	25
39	26
56	31
36	17
49	35

3. Carry out analysis of variance from following data and test the null hypothesis at 0.05 significance level.

**14**

A1				A2			
B1		B2		B1		B2	
C1	C2	C1	C2	C1	C2	C1	C2
53	30	43	16	67	56	51	41
32	41	39	28	57	41	45	47
65	32	41	30	51	66	67	56

### **OR**

Test the homogeneity of variance by Bartlett's test from the following data :

<b>Sr. No.</b>	<b>I</b>	<b>II</b>	<b>III</b>	<b>IV</b>
1	08	05	10	07
2	07	06	07	08
3	06	07	08	10
4	05	08	09	09
5	03	04	06	06

4. Answer any **two** of the following questions :

**14**

- (1) Test the null hypothesis at 0.05 level of significance by using Wilcoxon matched pair sign ranks test from following data :

Pairs	1	2	3	4	5	6	7	8	9	10
Method-I	14	14	21	10	13	25	13	25	21	23
Method-II	09	14	25	02	08	15	12	24	13	16

- (2) Test the null hypothesis by using Cochran Q test from following data :

Methods	1	2	3	4	5	6	7	8	9	10
I	1	0	0	1	0	1	1	1	0	1
II	1	0	1	0	1	1	0	1	0	0
III	1	1	0	0	1	0	1	0	0	1

- (3) Subject of four matched groups obtained the following scores under the four different conditions. Carry out Frideman's two way analysis of variance rank test. Test the significance of the conditions at 0.05 levels of significance.

Groups (N)	Conditions (K)			
	I	II	III	IV
A	10	06	05	08
B	07	07	05	08
C	10	04	07	09
D	06	03	05	05

- (4) Mental Health test was administered to some students of three schools. The scores obtained by them is as under. Test the null hypothesis by using Kruskal Wallis Test at 0.05 level of significance.

Schools	Scores							
X	20	32	23	40	26	34	37	52
Y	15	28	33	36	30	38	31	
Z	30	42	33	50	36			

5. Answer the following questions in short : (any **seven**)

**14**

- (1) Give the meaning of partial correlation and state its types.
  - (2) Give the meaning of contingency correlation coefficient and state when can be used.
  - (3) What is Analysis of Variance ? When three way analysis of variance can be used ?
  - (4) Give the meaning of Bartlet's test of homogeneity of variance and state its use.
  - (5) What is Null Hypothesis ? When  $H_0$  (hypothesis) is accepted and reject ?
  - (6) When Cochran 'Q' test can be used ?
  - (7) State the use of Kruskal Wallis test and which table used in this test ?
  - (8) State the use of Friedman's two way analysis of variance.
  - (9) State the meaning of degree of freedom.
-